

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ

શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય

તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની

લઘુસિંહનિષ્ઠીડિત મહાતપ સાધનાની યશોગાથા

JAIN KRANTI
જૈન ક્રાંતિ

Vol. 12 | Issue 12 | Mumbai | April - 2022 | Price Rs. 25/- | Pages : 28



તપોત્સવ

તપોત્સવનો અવસર અનેક માટે બન્યો અભયદાનોત્સવ, સંકલ્પોત્સવ અને પ્રેરણોત્સવ

100થી વધુ
સંત-સતીજીઓની
પાવન ઉપસ્થિતિ

તપસ્વી મુનિરાજને
ગોંડલ સંપ્રદાય દ્વારા નવાજવામાં
આવ્યા 'તપકેસરી' પદવીથી

3000થી વધુ પરિવારોએ
હોટલ કે રેસ્ટોરંટમાં કદી પણ
કંદમૂળ ન ખાવાની કરી પ્રતિજ્ઞા

350થી વધારે ભાવિકોએ
અહમ તપની આરાધના કરીને
કરી તપની અનુમોદના

અબોલ જીવો માટે
જાહેર થયું ત્રણ કરોડ
રૂપિયાનું અનુદાન

તવેણં ભંતે! જીવે કિં જણયઇ,
તવેણં વોદાણં જણયઇ ।

- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (29/29)

હે ભંતે ! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે ?

વૃપથી વ્યવહાર પ્રાપ્ત થાય છે.

વ્યવહાર એટલે કર્મોના
કારણનું નિરાકરણ લાવવું
માત્ર કર્મોનો નહીં, પરંતુ
કર્મોના કારણનો પણ ક્ષય કરાવે,

તે હોય છે
વૃપ!

સૌજન્ય: ગુરુભક્ત શ્રી મહેતા પરિવાર

Cost of શાંતિ

જીવનના વ્યવહારમાં હર એક વ્યક્તિને શાંતિની યાહ હોય છે,
અશાંતિના યાહક કોઈ નથી હોતા.
જેમ અત્યારે oxygen અને પાણીની કિંમત ચૂકવવી પડે છે,
તેમ શાંતિની પણ કિંમત ચૂકવવી પડે.

શાંતિની cost શું હોય ?

જો cost ખબર હોય તો જ ચૂકવી શકાય ને ?

શું હોય શાંતિની cost ?

શાંતિની cost છે, સહનશીલતા !

સહનશીલતા જેટલી વધારે, એટલી શાંતિ વધારે !

સહનશીલતા કેવી રીતે વધે ?

જેમ-જેમ તપ સાધના થતી જાય,

તેમ-તેમ તેની સહનશીલતા વધતી જાય.

જે સહન કરી શકે, તે જ તપ કરી શકે !

સૌજન્ય: ગુરુભક્ત, ઘાટકોપર

JAIN KRANTI જૈન ક્રાંતિ

5th April 2022, YEAR: 20, ISSUE - 253

PAGES : 24 + 4 • RETAIL PRICE : ₹ 25

તપસ્યા એ હોય,
જેનું reason પણ પ્રેમ,
જેનું result પણ પ્રેમ !

જગતના સર્વ જીવો પ્રત્યે પ્રેમ
અને વાત્સલ્યનો ભાવ પ્રગટાવવા
અને સ્વયંના આત્મબળનું
દંઢીકરણ કરવા માટે હોય છે,

વૃષ્ટિનો ઉત્સવ !

તપોત્સવ વિશે જાણવા, તપોત્સવની સ્મૃતિ દ્વારો માણવા
વાંચો જૈનક્રાંતિનો આ અંક...

: FORMER EDITOR :
SHREE RASIKBHAI PAREKH

: PUBLISHER :
SHREE DEEPAKBHAI BHAYANI

: EDITOR :
SHREE PRATIMABEN BADANI

: CONTACT :
PARASDHAM
VALLABH BAUG LANE, TILAK ROAD
GHATKOPAR (E) MUMBAI - 400077
PH: +91-22-25015152

: EMAIL :
connect@parasdham.org
website: www.parasdham.org

: JOIN US ON :
www.facebook.com/ParasdhamIndia
www.youtube.com/ParasdhamTV

Printed, Published, Edited and Owned by
DEEPAK K. BHAYANI

Printed at
Arihant Printing Press
Ghatkopar (E), Mumbai - 400 077
and
Published at
202, Satellite Building,
Opp. Mistry Complex, J. B. Nagar,
Andheri (East), Mumbai - 400 099

: SUBSCRIPTION :

LIFE TIME (WITHIN INDIA)	: ₹ 2500
FOR 2 YRS. (WITHIN INDIA)	: ₹ 500
LIFETIME (INTERNATIONAL)	: ₹ 20000
FOR 1 YR. (INTERNATIONAL)	: ₹ 2500

આપશ્રીને 'જૈન ક્રાંતિ'ને અનુદાન આપવું હોય તો
સંપર્ક : +91-9324808181

TO KNOW MORE ABOUT
PARAM GURUDEV
CONTACT ON: +91-9860905678

હે પરમાત્મા ! ગુરુકૃપાએ આજે મને મારા આત્માની શુદ્ધિના ભાવ થયાં છે અને આત્મશુદ્ધિના પ્રયોગરૂપ તપસાધના કરવાના પણ ભાવ થયાં છે, ત્યારે **હે પ્રભુ !** હું સર્વ પ્રથમ કર્મોની નિર્જરા કરાવતાં તે તપને નમસ્કાર કરું છું. જે-જે આત્માઓ તપસાધના દ્વારા સ્વયંના આત્માની શુદ્ધિ કરી રહ્યાં છે, તે સર્વ આત્માઓને ભાવથી વંદન કરું છું.

હે પરમાત્મા ! તપસાધના દ્વારા મારે અનાદિકાળની વૃત્તિને શાંત કરવી છે. પ્રભુ ! મારે મારી આસક્તિને ઘટાડવી છે. પ્રભુ ! મારે કર્મોની નિર્જરા સાથે કર્મોના કારણનું પણ મૃત્યુ કરવું છે.

પ્રભુ ! મને એવી શક્તિ અને સમજ આપો.

પ્રભુ ! મારે માત્ર આહારના ત્યાગરૂપ તપ નથી કરવું,

પ્રભુ ! મારે મારા અવગુણોના ત્યાગરૂપ તપ પણ કરવું છે,

પ્રભુ ! મારામાં એવો વિનયભાવ પ્રગટ થાય એવી કૃપા કરો... કૃપા કરો...

પ્રભુ ! તપની આરાધના મારી આત્મશુદ્ધિનું પરિબળ બને, તપની આરાધના મારી અંતરાયોને દૂર કરે અને **પ્રભુ !** મને આપની સમીપ લઈ આવે, એવી કૃપા કરો, પ્રભુ ! એવી કૃપા કરો... કૃપા કરો...

કર્મના કારણને ક્ષય કરે તપ



જ્યારે એક વ્યક્તિને પોતાના આત્માની શુદ્ધિનું લક્ષ્ય જાગે છે, પોતાના અવગુણોને શુદ્ધ કરવાના ભાવ જાગે છે, અંદરથી પ્રેરણા જાગે છે ત્યારે જ તેને આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરવાનું મન થાય છે.

અશુદ્ધિનો અનુભવ થાય તેને જ શુદ્ધિનો પ્રયોગ કરવાનું મન થાય.

કોઈ વ્યક્તિ ગામડામાં રહેતો હોય અને તે કાચમ ધૂળ, કાદવ અને કીચડથી ખરડાયેલો જ રહેતો હોય તેને કદાચ શુદ્ધિનો વિચાર ન આવે, કેમ કે, તે એ બધાંથી attach થઈ ગયો હોય, તેનો સ્વીકાર હોય એટલે તેને તેની અકળામણ ન હોય.

તપ એ શું છે ?

તપ એ અશુદ્ધિને શુદ્ધ કરવાની process છે, પણ જ્યાં સુધી અશુદ્ધિનો અનુભવ ન થાય, અશુદ્ધિ અશુદ્ધિ ન લાગે ત્યાં સુધી શુદ્ધિનો પ્રયોગ પણ સાર્થક ન થાય.

આત્માની શુદ્ધિના પ્રયોગને તપ કહેવાય છે. બીજા તપ કરે છે, માટે હું પણ તપ કરું, મારા status માટે તપ કરું, એવી વ્યક્તિ ક્યારેય નમો તવસ્સ પદમાં ન આવે.

નમો તવસ્સ પદમાં એ જ વ્યક્તિ આવે જેને પોતાનું અજ્ઞાન, પોતાના અવગુણો દેખાય અને તેને દૂર કરવા માટેના ભાવ જાગે.

માનો કે, તમે આજે તપ કર્યું એટલે આજે થોડા કર્મો ખપાવ્યા, પણ કાલે પાછા જમવાના, એટલે પાછા કર્મો બંધાવાના, આજે ખપાવ્યા, કાલે બાંધ્યા, પાછા ખપાવ્યા, પાછા બાંધ્યા. તો પછી કર્મોની નિર્જરા કેવી રીતે થાય ?

જે બંધાવાનું જ છે એને ખપાવવાથી શો ફાયદો ?

તપ એ દ્રવ્ય કર્મને ખપાવવાની process નથી, તપ એ ભાવકર્મને ખપાવવાની process છે.

તપ શા માટે કરવાનું ?

તપ કર્મોને ખપાવવા માટે નહીં, પણ કર્મોના કારણને ખપાવવા માટે કરવાનું.

કર્મોના કારણને ભાવ કર્મ કહેવાય છે.

આહાર છૂટે તે તપ નથી, આહાર પ્રત્યેની સંજ્ઞા છૂટે, આહાર પ્રત્યેની આસક્તિ છૂટે તે તપ છે.

આયંબિલ કરીને કદાચ તમે રૂક્ષ પદાર્થ ભોગવી લીધા, તો તે તપ નથી, પદાર્થ પ્રત્યેની રસ વૃત્તિ છૂટે તે તપ છે. પદાર્થ પ્રત્યેનું attachment, પદાર્થ પ્રત્યેનું આકર્ષણ છૂટે તે તપ છે.

આહારનો ત્યાગ એ તપશ્ચર્યા ન હોય, આહાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ એ તપશ્ચર્યા હોય.

કર્મો ખપે તે તપ નથી, કર્મોના કારણ ખપે તે તપ છે.

ભગવાને બે પ્રકારના તપ બતાવ્યાં છે : એક બાહ્ય તપ અને એક આભ્યંતર તપ. આભ્યંતર તપ એટલે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ. બાહ્ય તપ એટલે અનશન, ઉણોદરી, રસપરિત્યાગ, કાયાકલેશ, વૃત્તિસંક્ષેપ અને પ્રતિસંવીનતા.

આ બંને પ્રકારના તપમાં શ્રેષ્ઠ કયું તપ ? ઉપવાસ શ્રેષ્ઠ કે વિનય શ્રેષ્ઠ ? પ્રાયશ્ચિત શ્રેષ્ઠ કે ઉણોદરી શ્રેષ્ઠ ?

ભગવાન કહે છે, જેને આહાર પ્રત્યે અત્યંત આસક્તિ હોય તેના માટે ઉપવાસ શ્રેષ્ઠ છે.

જેવી પ્રકૃતિ તેવી પ્રવૃત્તિ... !

જેવી પ્રકૃતિ હોય તેવા પ્રકારનું તપ કરીએ તો તે સાર્થક થાય.

જેની બાહ્ય વૃત્તિ વધારે પ્રબળ હોય તેના માટે આભ્યંતર તપ શ્રેષ્ઠ છે, અને જેની અંતરમુખતા વધારે હોય તેના માટે બાહ્ય તપ શ્રેષ્ઠ છે.

ગુરુ શું કરે ?

એ જ્યારે એમના visionમાં જુએ કે આ ભક્તને... આ વ્યક્તિને સેવા ખૂબ જ ગમે છે, તો તેને સેવાના બદલે સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપે.

તપ ચાહે જે પણ હોય, જો ગુરુ આજ્ઞાથી થાય તો જ સાર્થક થાય.

કેમ કે, ગુરુ જ આપણી રૂચિ અને આપણી પ્રકૃતિને જાણતા હોય અને એ પ્રકૃતિના મારણ માટે... એ વૃત્તિના મારણ માટે જે યોગ્ય હોય તે જ આજ્ઞા આપે અને આજ્ઞા દ્વારા આપણી વૃત્તિનું મૃત્યુ કરાવે.

વૃત્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તપશ્ચર્યા સાર્થક થાય છે.

જેના દ્વારા પ્રકૃતિનું પોષણ થાય તેને ક્યારેય તપ ન કહેવાય.

તપ એ જ કહેવાય જે તમને મોક્ષના પંથે આગળ વધારે.

ઘણા વટથી કહેતા હોય કે, પર્યુષણ આવે એટલે મારી અઠ્ઠાઈ તો હોય જ !

એનો અર્થ એ જ થયો કે, અઠ્ઠાઈ એ એનું status બની ગઈ, એની image બની ગઈ, એના અહમ્નું કારણ બની ગઈ. મતલબ એની અઠ્ઠાઈ પ્રકૃતિના મારણને બદલે પ્રકૃતિનું કારણ બની ગઈ.

કોઈ પણ સાધના કરતો સાધક જો પોતાની અંદરના કારણને ઓળખી ન શકે, તો જે કારણ ધર્મનું હોય તે જ કારણ અધર્મનું થઈ જાય માટે જ, ગુરુનું મહત્વ છે, સાધનામાં ગુરુની આજ્ઞાનું મહત્વ છે.

તપ એ જ કહેવાય, જે તમારી પ્રકૃતિને મંદ કરે, તમારી વૃત્તિને મંદ કરે, તમારા શોખને, સ્વાદને અને તમારી આશા-અપેક્ષાઓને ઘટાડે. અંદરમાંથી જાગતી વિભાવ વૃત્તિને ઘટાડે.

તપ એ કર્મોની નિર્જરા નથી પણ અંદરમાં રહેલી આસક્તિનો ત્યાગ એ કર્મની નિર્જરા છે. અંદરમાં રહેલી અનાદિકાળની વૃત્તિનો ત્યાગ એ કર્મની નિર્જરા છે.

તપધર્મની આરાધના માટે ભગવાને 12 પ્રકાર બતાવ્યાં છે. જેમાં છ બાહ્યતપ છે અને છ આભ્યંતર તપ છે.

આ 12 પ્રકારના તપ દ્વારા તમે કર્મોની નિર્જરા કરી શકો છો. **અનશન** એટલે ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ, એ ન થઈ શકે

પણ ભૂખ કરતાં થોડું ઓછું ભોજન લઈને **ઉણોદરી** નામનું તપ તો થઈ શકે ને ! ક્યારેક આહાર માટે કોઈ અભિગ્રહ ધારણ કરી, **વૃત્તિસંક્ષેપ** તપ કરી શકાય, ભગવાન મહાવીરે 13 બોલનો અભિગ્રહ ધારણ કરી, કર્મક્ષયનો પુરુષાર્થ કર્યો હતો, તમે 1 અથવા બે બોલનો અભિગ્રહ એટલે કે સંકલ્પ કરી વૃત્તિસંક્ષેપ નામનું તપ કરી શકો છો, **રસ પરિત્યાગ** એ તપ છે, જેમાં વિગય રહિતનો આહાર વાપરવાનો હોય. વિગય એટલે ઘી, તેલ, દૂધ, દહી, ગોળ, સાકર, મધ અને માખણ વિનાનો આહાર ! સ્વાદ અને આહારસંજ્ઞા પર વિજય મેળવવા માટે છે, રસ પરિત્યાગ તપ !

કાયાકલેશ અર્થાત્ કાયાને કષ્ટ આપવું, લોચ કરવો, ખુલ્લા પગે ચાલવું, તડકામાં આતાપના લેવી, કઠિન આસન એટલે કે શીર્ષાસન આદિ કરવું. ઉપવાસ, આયંબિલ ન થઈ શકે પણ કાયાકલેશ તપ તો થઈ શકે ને ! કર્મોની નિર્જરા સાથે સહનશીલતા પણ વધે.

પ્રતિસંલીનતા એટલે કે ઇન્દ્રિયો પર control કરવો. ઇન્દ્રિયોને શાંત કરવી, ઇન્દ્રિયોનો ઉપયોગ ઘટાડવો, એકાંત સ્થાને બેસવું, મન, વચન અને કાયાના યોગના ઉપયોગને જેટલો બની શકે એટલો ઘટાડવો.

તપ એ જૂના કર્મોનો ક્ષય કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે, કાંઈ ન થાય તો દરરોજ નવકારશી તો કરી જ શકો.

પ્રાયશ્ચિત દ્વારા pastની ભૂલોને delete કરી દો. દરરોજ સવારે ઊઠીને દેવ, ગુરુ, ધર્મને ભાવથી નવ વંદના કરો, અહોભાવથી દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે વિનયભાવ પ્રગટ કરો, ભગવાને **વિનયને** પણ એક પ્રકારનું તપ કહ્યું છે.

આખા દિવસમાં કોઈની સેવા કરો, વડીલોના પગ દબાવો, સાધુ-સંતોની વૈયાવચ્ચ કરો, તપસ્વીની પણ સેવા અને વૈયાવચ્ચ કરવી એ પણ એક પ્રકારનું તપ છે.

આખા દિવસમાં તમને તમારી પ્રવૃત્તિઓની વચ્ચે-વચ્ચે 2-5-8-10 મિનિટનો સમય મળતો જ હોય છે. એ સમયે શું કરવાનું ?

બાહ્ય ઇન્દ્રિયોથી અલિપ્ત થઈ, આત્મિક અતિન્દ્રિય અવસ્થામાં પહોંચી જવાનું, જેને કહેવાય છે **ધ્યાનની** સાધના ! ધીમે-ધીમે ધ્યાનથી તમારું vision અને તમારી આત્મિક ક્ષમતા પ્રગટ થવા લાગશે. ધ્યાનથી તમે, તમને મળી શકશો.

એક નિયમ હોવો જોઈએ કે, આખા દિવસમાં મારે ઓછામાં ઓછું એક page તો પ્રભુ વચનનો **સ્વાધ્યાય** કરવો છે, વધારે થાય તો શ્રેષ્ઠ, પણ એકવાર આખા દિવસમાં પ્રભુની વાણીનું શ્રવણ અથવા વાંચન કરી પ્રભુ સાથે connect થવું છે.

સ્વાધ્યાય તો સાધકનો શ્વાસ હોય !

જેમ શ્વાસ વિના ન જીવાય એમ સ્વાધ્યાય વિના ન રહેવાય, અને એક તપનું નામ છે, **કાઉસગ્ગા !**

જ્યારે-જ્યારે 2-3-5 મિનિટનો સમય મળે નમસ્કાર મંત્ર અથવા લોગસ્સનો કાઉસગ્ગા કરી દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવો જોઈએ.

આ 12 પ્રકારના તપ ઉપરાંત ભગવાને રાત્રિ ભોજનના ત્યાગને પણ તપ કહ્યું છે.

આત્મશુદ્ધિના લક્ષ્ય સાથે, કર્મોની નિર્જરા કરવા માટે તપ શ્રેષ્ઠ સાધના છે.

પાપને ઘોવાનું

વપ



પ્રાયશ્ચિત

જગતમાં બે પ્રકારના thinkingવાળી વ્યક્તિઓ હોય: એક, જે પાપને કર્યા પછી કરવા જેવું માને અને બીજા, જે પાપ કરે પણ એને ક્યારેય કરવા જેવું ન માને.

જે પાપને કરવા જેવું ન માને તેના મનમાં પસ્તાવો હોય અને તેના thinkingમાં પખેપખનું પ્રતિક્રમણ હોય.

પ્રતિક્રમણ એટલે શું ?

માનો કે તમે અમદાવાદથી પાલિતાણા જઈ રહ્યા છો. અચાનક તમે sign board જુઓ અને તમને ખબર પડે કે તમારી car wrong directionમાં જઈ રહી છે. હવે તમે શું કરશો ? તમે તરત જ તમારી carને reverse લઈને right directionમાં લઈ જશો.

એવી જ રીતે wrong track પર ગયેલા મનને, wrong track પર ગયેલા વચનને અને wrong track પર ગયેલી કાયાને reverseમાં લાવવા જે process કરીએ એને પ્રતિક્રમણ કહેવાય.

જ્યારે-જ્યારે કંઈ પણ wrong action કે wrong activity થાય ત્યારે જ, એ જ ક્ષણે sorry કહીને reverse આવવું એને પખેપખનું પ્રતિક્રમણ કહેવાય.

માનો કે તમારા અને તમારા father વચ્ચે

business discussion ચાલી રહ્યું છે. તમે કહો છો કે આપણે આ માલ Chinaથી import કરીએ. તમારા father ના પાડે છે. તમે તમારી વાત પ્રમાણે father માને એવો આગ્રહ રાખો છો, પણ fatherની ઇચ્છા ન હોવાથી તે ના જ પાડે છે. એ સમયે તમે અકળાઈને, ઊંચા અવાજે father સાથે argument કરો છો. Father મૌન છે કેમ કે, તેમને hurt થાય છે.

એ જ સમયે તમને realize થાય છે કે મારા volume અને મારા શબ્દોને કારણે મારા fatherને hurt થયું છે. કદાચ અનુભવના આધારે જ તે Chinanના માલની ના પાડતા હશે.

આ realize થતાં તરત જ તમે fatherને sorry કહી દીધું, હવે શું થાય ?

તમારું એ પાપ જે તમારા આત્મા સાથે connect થવા જઈ રહ્યું હતું એ connect થતાં-થતાં જ disconnect થઈ ગયું.

સામેવાળાને hurt થાય એ જ સમયે sorry કહો અને મહિના પછી sorry કહો એમાં શું ફરક હોય ? ચાર મહિના પછી sorry કહો એમાં પણ ફરક હોય અને વર્ષ પછી sorry કહો એમાં પણ ફરક હોય. કેમ કે, ત્યાં સુધી hurt થયાની feelings બહુ strong set થઈ ગઈ હોય. તરત જ sorry કહી દીધું, વાત ત્યાં જ પૂરી થઈ જાય અને બધું ભૂલાઈ પણ જાય.

પાપમય પ્રવૃત્તિથી પાછા ફરવું એ પ્રભુના સાધકની સમજ કહેવાય, એ તેનો વિવેક કહેવાય.

જેમાં પસ્તાવો તરત જ થઈ જાય એ પાપ તમારાથી અલગ થઈ જાય, જેનાથી એ પાપને ભોગવતી વખતે વેદના પણ બહુ જ ઓછી હોય.

પ્રભુનો સાધક પાપ વખતે સાવધાન હોય

અને પાપ થઈ ગયા પછી પ્રભુ સાથે સમાધાન કરી લે એવો હોય.

તમે જ્યારે કોઈને hurt કરો, કોઈનું અપમાન કરો, કોઈના પર ગુસ્સો કરો, કોઈની સાથે negative behavior કરો ત્યારે તમારો ચહેરો કેવો હોય ? ભારે હોય કે હળવો હોય ? Dull હોય કે fresh હોય ? ભારે અને dull હોય. Right? પણ એ જ ક્ષણે તમે તમારા ego અને આગ્રહને છોડીને I am sorry એટલું જ કહી દો તો શું થાય ? તમારો બધો ભાર ઊતરી જાય અને તરત જ તમારા ચહેરા પર હળવાશ અને પ્રસન્નતા આવી જાય.

જો પ્રભુનો ચહેરો always smiling હોય તો પ્રભુના શ્રાવકનો ચહેરો પણ smiling જ હોવો જોઈએ.

પ્રાયશ્ચિત નામના તપનું result શું હોય ? તમારા ચહેરા પર સદાય સ્મિત હોય એ આ પ્રાયશ્ચિત તપનું result હોય.

ધર્મની real activity શું છે ? પખેપખનું પ્રતિક્રમણ એ ધર્મની real activity.

તમારી car wrong track પર ચડી ગઈ હોય, તમે confuse અને upset હોવ, પણ right track પર આવી જાય તો તમે શાંત અને પ્રસન્ન થઈ જાઓ. તમને શું જોઈએ છે ? તમારી life કેવી હોવી જોઈએ ? તમારા ચહેરા પર હાશ હોવી જોઈએ કે ત્રાસ ?

તો આજથી તમારી પાપની ગાડીને reverseમાં લેતાં શીખી જાવ. ગમે ત્યાં, ગમે ત્યારે, જ્યાં mistake થઈ એવું realize થાય એટલે તરત જ પસ્તાવાના ભાવ સાથે વિવેકપૂર્વક કહી દો, I am sorry. તમારા ચહેરા પર સદાય પ્રભુ જેવું smile આવી જશે.

પાપ થવું એ આપણી પરિસ્થિતિ છે અને પસ્તાવો કરવો કે ન કરવો એ આપણી મન:સ્થિતિ છે.

તમે સંસારમાં છો, સ્નાન કરવું એ તમારી પરિસ્થિતિ છે, પણ સ્નાન કરીને બહાર નીકળો અને પ્રભુની સમક્ષ પસ્તાવાના ભાવ વ્યક્ત કરી દો, હે પ્રભુ! ક્યારે મને એવું શરીર મળે, ક્યારે મને એવી આત્માની અવસ્થા મળે કે હું fresh થાઉં પણ કોઈ crash ન થાય, મારા માટે કોઈની હિંસા ન થાય.

આવો એક વિચાર અને બે lineની અભિવ્યક્તિ થઈ શકે કે ન થઈ શકે ?

તમે સ્નાન કરતા હો અને ભૂલથી તમારી આંખમાં સાબુ જાય તો તમને કેટલું pain થશે, કેટલી વેદના થશે અને એ વેદનામાંથી મુક્ત થવા, આંખમાં ગયેલા સાબુને બહાર કાઢવા તમારો પુરુષાર્થ કેવો હશે ?

વિચાર કરો, સ્નાન વખતે નીકળતું સાબુ-shampooવાળું પાણી ક્યાં જાય છે ? તમારી ગટરની lineમાં. એ ગટરમાં નાના-નાના અસંખ્ય જીવ-જંતુઓ હોય છે. સાબુવાળું એ પાણી એમને પીડા આપે કે પ્રસન્નતા આપે ?

સ્નાન તમારા માટે જરૂરી છે, પણ સ્નાન પછી પસ્તાવો પણ થઈ શકેને.

જે પાપ પસ્તાવા વિનાનાં હોય છે એ પાપના પરિણામરૂપે જે પીડા મળે છે એ અનંતગણી મળે છે.

માનો કે એક વ્યક્તિ car ચલાવે છે અને અચાનક એની car નીચે એક ફૂતરું આવી જાય છે. એને ખૂબ જ વાગી જાય છે, ભયંકર વેદના થાય છે અને એ રડી રહ્યું છે. ત્યારે શું થાય ?

Car ચલાવવાવાળી વ્યક્તિની બે પ્રકારની



માનસિકતા હોય. એક વિચારે, આ સરકારને કંઈ પડી જ નથી. રસ્તામાં ફૂતરા રખડતા રહેવા દે છે, પછી અમારા જેવાની car નીચે આવી જ જાય, આના કરતાં તો foreign સારું. ત્યાં ક્યાંય આવા street dog હોય જ નહીં એટલે કોઈ ચિંતા જ નહીં.

બીજો વિચારે, અરરર! મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. મારા કારણે એ જીવને કેટલી પીડા થાય છે. હે પ્રભુ! તસ્સ મિચ્છામિ દુક્કડમ્, પ્રભુ, હવેથી હું ધ્યાન રાખીને car ચલાવીશ. Sorry પ્રભુ, sorry dog.

એકને પાપ પછી anger અને ego આવે છે અને બીજાને પાપ પછી પસ્તાવો થાય છે.

બન્નેની વિચારધારાને કારણે બન્નેનાં પરિણામ કેવાં હશે ? પહેલી વિચારધારાવાળી વ્યક્તિનો ભવિષ્યમાં truck કે car સાથે accident થાય અને હાથ-પગમાં fracture આવે, ભયંકર પીડા થાય એવા કર્મ બંધાશે. જ્યારે બીજી વ્યક્તિને પણ વાગશે, પણ hairline

crack જ આવશે. કેમ કે, પસ્તાવાના ભાવને કારણે તેના પાપની તીવ્રતા મંદ થઈ ગઈ હતી.

પહેલી માનસિકતાવાળી વ્યક્તિની carની નજીક બીજી વાર ફૂતરું આવશે તો પણ એને કંઈ ફરક નહીં પડે, જ્યારે બીજી માનસિકતાવાળી વ્યક્તિ જ્યારે પણ દૂરથી ફૂતરાને જોશે કે તરત જ carને brake મારી દેશે.

પસ્તાવા સાથેનું પાપ એ જૈનત્વની નિશાની છે, એ પ્રભુ મગ્યાની પ્રતીતિ છે, એ ધર્મની અનુભૂતિ છે.

પરંતુ, પ્રાયશ્ચિત માત્ર હોઈથી નહીં, heartથી હોવું જોઈએ અને વર્ષમાં એકવાર નહીં, જ્યારે-જ્યારે ભૂલ થાય, જ્યારે અયોગ્ય થાય ત્યારે થવું જોઈએ.

ભગવાને કહ્યું છે, જેમને 'તસ્સ મિચ્છામિ દુક્કડમ્' આ એક વાક્ય બોલતાં આવડી જાય તેને art of living આવડી જાય.

તમે જેવું તસ્સ મિચ્છામિ દુક્કડમ્ બોલ્યા એટલે એ સમયે તમારાથી જે પાપ થયાં હોય એ ધોવાઈ જાય, મંદ થઈ જાય.

તમે ચા પીતા હો અને એ ચા તમારા નવા shirt પર ઢોળાય તો તમે શું કરો ? એમ જ રહેવા દો કે તરત જ ધોઈ નાખો ? તમને ખબર છે કે તરત જ ધોઈ નાખીશ તો ડાઘ નીકળી જશે અને રહેવા દઈશ તો ડાઘ નીકળવા મુશ્કેલ થઈ જશે. એમ તરત જ તસ્સ મિચ્છામિ દુક્કડમ્ કહી દીધું એટલે આત્મા પર લાગેલો પાપનો ડાઘ ધોવાઈ ગયો, તમારા પાપની તીવ્રતા મંદ થઈ ગઈ.

પ્રભુના ઉપાસક તે જ હોય જેનાં પાપ અતિ મંદ હોય.

તમે જેવું તસ્સ મિચ્છામિ દુક્કડમ્ બોલો એટલે તમારા એ પાપનું connection disconnect થવા લાગે.

પ્રભુ સમાન બનવાનું વૃક્ષ વિનય

‘કાંટાનું connection ? એ ક્યાં હોય ?’

અનુભવી વ્યક્તિએ કહ્યું, ‘કાંટાનું connection ઝાડનાં મૂળ સાથે હોય છે. કાંટાને કાયમ માટે કાઢવા હોય તો તેનાં મૂળને કાઢવાં જોઈએ.’

આગળ જતાં બીજા એક ભાઈએ અનુભવી વ્યક્તિને પૂછ્યું, ‘અમે આ ફળ ખાઈ રહ્યાં છીએ અને વિચારી રહ્યા છીએ કે આ ફળમાં આટલી બધી મીઠાશ ક્યાંથી આવી ? શું આ ફળની સ્વયંની શક્તિ છે ? આ ફળોને આટલાં રસવાળાં અને મીઠાં કોણ બનાવે છે ?’ અનુભવી વ્યક્તિએ કહ્યું, ‘ના ! આ ફળો પોતાની જાતે આટલાં સ્વાદિષ્ટ ન બની શકે. એમનું ક્યાંક ને ક્યાંક connection હોય છે.’

વ્યક્તિએ પૂછ્યું, ‘મીઠાશનું, ફળનું connection ? એ ક્યાં હોય ? કોની સાથે હોય ?’ અનુભવી વ્યક્તિએ કહ્યું, ‘એનું connection હોય છે વૃક્ષનાં મૂળિયાં સાથે. મૂળિયાંમાંથી પોષણ મળે છે એટલે તેનો વિકાસ થાય છે.’

એ જ રીતે, ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરને પૂછ્યું, હે ભંતે ! મોક્ષમાં પરમ સુખ, શાંતિ અને સમાધિ છે. પ્રભુ ! મોક્ષનું connection ક્યાં છે ? કોની સાથે છે ? પ્રભુએ કહ્યું, હે ગૌતમ ! મોક્ષનું connection છે ‘વિનય’ સાથે. જે વૃક્ષમાં વિનયરૂપી મૂળ હોય તે જ વૃક્ષ પર મોક્ષરૂપી ફળ આવે. અને માટે આત્મસાધનાનું પ્રથમ પગથિયું ‘વિનય’ છે.

જે આત્મામાં વિનય નામનો ગુણ હોય તે જ આત્મા મોક્ષનો અધિકારી હોય.

આ સંસારમાં પણ સુખનું કારણ વિનય છે અને દુઃખનું કારણ અવિનય છે. જ્યાં

વિનય હોય છે ત્યાં સુખનાં ફળ હોય છે, જ્યાં અવિનય હોય છે ત્યાં દુઃખના કાંટા હોય છે.

વિવત્તિ અવિણીયસ્સ, સંપત્તિ વિણીયસ્સ ય જસ્સેયં દુહઓ ગાયં, સિક્ખં સે અભિગચ્છઈ ।।

(શ્રી દશવૈકાલિક સૂત્ર 9/22)

જ્યાં વિનય હોય છે ત્યાં સદ્ગુણો હોય છે. કેમ કે, વિનય જ સર્વ ગુણોની જનની છે.

જેમને આત્મશુદ્ધિ કરવી છે, જેમને આત્મસાધના કરવી છે, જેમને મોક્ષરૂપી ફળ મેળવવું છે તેમણે સૌપ્રથમ વિનય ગુણને કેળવવો જોઈએ, વિનયભાવને પ્રગટ કરવો જોઈએ. કેમ કે, જ્યાં વિનય છે ત્યાં જ્ઞાન છે, જ્યાં વિનય છે ત્યાં સમજ છે અને જ્યાં વિનય છે ત્યાં right vision છે.

જેમની પાસે જ્ઞાન છે, સમજ છે અને right vision છે તેમનું decision અને direction પણ right જ હોય છે.

વ્યક્તિ યાહે સંસારમાં હોય કે અધ્યાત્મના માર્ગે હોય, હર એક પગલે decision લેવું જ પડતું હોય છે. હું આમ કરું કે આમ ? આ યોગ્ય હશે કે આ ? ક્યારે શું કરવું જોઈએ એની જેમને ખબર પડે છે તે right decision લઈ શકે છે અને તે સદાય સુખી થાય છે. જે right decision લઈ શકે છે તે દરેક ક્ષેત્રમાં સફળ થાય છે.

Right decision કોણ લઈ શકે ?

Right decision એ જ લઈ શકે જેમની પાસે જ્ઞાન હોય, સમજ હોય અને right vision હોય. Right vision, જ્ઞાન અને સમજ આવે ક્યાંથી ? Right vision, જ્ઞાન અને સમજ પ્રગટાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે, વિનય !

વિનય જ્યારે પ્રગટે ત્યારે પોતાની આવડતનો અહંકાર શૂન્ય થઈ જાય છે.

એક વ્યક્તિ પોતાના ખેતરના માર્ગે પસાર થઈ રહી હતી. એક જગ્યાએ તેના પગમાં કાંટા વાગવા લાગ્યા, તેણે આસપાસ જોયું. પછી ઉપર નજર કરી તો ખબર પડી કે કાંટા ઝાડ પરથી નીચે ખરતા હતા અને તેના પગમાં વાગતા હતા. તેણે ઝાડ પરના કાંટાને દૂર કર્યા.

થોડા દિવસ પગમાં કંઈ ન વાગ્યું, પણ થોડા દિવસ પછી ફરી તે જ ખેતરના માર્ગે જતાં કાંટા વાગવા લાગ્યા. ફરી ઝાડ પર નજર કરી, ઝાડ પર ઘણા નવા કાંટા આવી ગયા હતા, તેણે તે દૂર કર્યા. આમ ત્રણ-ચારવાર કર્યા પછી તેને વિચાર આવ્યો કે આનું solution શું ? શું કરું તો કાંટા ઊગે જ નહીં અને વાગે જ નહીં.

તેણે ત્યાંથી પસાર થતી એક અનુભવી વ્યક્તિને એનું કારણ અને સમાધાન પૂછ્યું. અનુભવી વ્યક્તિએ કહ્યું, ‘ભાઈ ! કાંટા એમ ને એમ નથી ઊગતા, ક્યાંક ને ક્યાંક કાંટાનું connection હોય છે.’ તે વ્યક્તિએ પૂછ્યું,

બે મિત્રો દરિયાકિનારે બેઠા-બેઠા વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક તેમણે જોયું કે દૂરથી સુનામી આવી રહી છે. બંને મિત્રો જલ્દી-જલ્દી ઊભા થયા. એક મિત્ર રોડ પર દોડવા લાગે છે. તેને એમ છે કે 'હું દોડીને દૂર સુધી ભાગી જઈશ.' બીજો મિત્ર સામે જે દસ માળનું building દેખાતું હતું તેની terrace પર ચડી જાય છે.

બંનેમાં સાચું કોણ ? જ્ઞાની કોણ ? સમજુ કોણ ?

જેની પાસે જ્ઞાન હતું તેની પાસે સમજ હતી અને right vision પણ હતું એટલે તેણે right decision લીધું અને terrace પર પહોંચી ગયો. જેની પાસે જ્ઞાન નહોતું તેણે wrong decision લીધું.

જ્ઞાનનું connection હોય છે વિનય સાથે ! જેટલો વિનય વધારે એટલી સમજ વધારે ! જ્યાં વિનય હોય છે ત્યાં જ્ઞાન પ્રગટ થાય છે. જ્યાં અવિનય હોય છે ત્યાં અજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનના કારણે vision clear હોય છે અને vision clear હોવાના કારણે decision right લઈ શકાય છે.

'વિનય'ની વ્યાખ્યા શું છે ?

વિનયની એક વ્યાખ્યા છે, જેમાં તમારો અહં શૂન્ય થાય તે વિનય કહેવાય.

વિનય ક્યાં કરવાનો હોય ? શું વિનય માત્ર ગુરુ કે પરમાત્મા પ્રત્યે જ હોય ? શું વિનય માત્ર વડીલો માટેનો જ હોય ?

ના, વિનય સર્વત્ર હોય, સર્વ માટે હોય. વિનય દરેક ક્ષેત્રમાં હોય, દરેક વ્યક્તિ માટે હોય. વિનય સૃષ્ટિના જીવ માત્ર પ્રત્યે હોય. વિનય જડ માટે પણ હોય અને ચેતન માટે પણ હોય. વિનય એટલે વિનમ્રતા. વિનય એટલે અહંકાર શૂન્યતા.

જેમનામાં વિનય હોય તેને શું પ્રાપ્ત થાય ?

જેમનામાં વિનય હોય તેને બધાનો પ્રેમ, મિત્રતા, માન અને સન્માન તો પ્રાપ્ત થાય; પણ જેમ-જેમ તેનો વિનયભાવ વધતો જાય તેમ-તેમ તેનાં જ્ઞાનાવરણીય કર્મો ક્ષય થતાં જાય, જેમ-જેમ કર્મો ક્ષય થતાં જાય તેમ-તેમ સત્ય પ્રગટ થાય, સત્યના માર્ગે આગળને આગળ વધે અને એક દિવસ આત્મશુદ્ધિ કરતાં-કરતાં કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે.

જેમને આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી છે તેમના માટે વિનય ગુણનું પ્રાગટ્ય અત્યંત જરૂરી છે. કેમ કે, વિનયને કારણે જ right decision લઈ શકાય છે અને right directionમાં પ્રગતિ કરી શકાય છે... પ્રગતિ યાહે ધર્મક્ષેત્રની હોય કે સંસારના ક્ષેત્રની જીવનની દરેક પ્રગતિનું base વિનય હોય છે.

યાદ રાખજો, ગુરુ અને પ્રભુ મળે છે પુણ્યથી, પણ ફળે છે વિનયથી.

Good luckને કારણે ગુરુ, પરમાત્માનો યોગ કદાચ થઈ જાય, પણ એ યોગ ઉપયોગી ક્યારે થાય ? જ્યારે તમારામાં વિનયભાવ હોય. જેટલા પણ આત્માઓનાં સાંનિધ્ય સાર્થક થયાં છે તે વિનયને કારણે, જેટલા પણ આત્માઓ મોક્ષમાં ગયા છે તે વિનયભાવના પ્રાગટ્યને કારણે !

વિનયથી ગુરુ અને પ્રભુ સાથે connection થાય છે અને એ connectionને કારણે જે ગુણો ગુરુ અને પ્રભુમાં હોય છે તે તમારામાં transfer થાય છે.

ઘરચાતો આગ્રહ છોડવાનું

વિનય



Power houseની બાજુમાં ઘર હોય એટલા માત્રથી તમારા ઘરમાં પ્રકાશ ન આવે. પ્રકાશ માટે power houseમાંથી connection લેવું પડે. તેમ ગુરુના સાંનિધ્યમાં આવવા માત્રથી આત્મશુદ્ધિ કે આત્મજ્ઞાન ન થાય. તે માટે વિનયભાવથી ગુરુ સાથે connection કરવું પડે !

જેમ-જેમ વિનયભાવ આવતો જાય તેમ-તેમ ધર્મ કરવો ન પડે, ધર્મ થઈ જાય. ધર્મ અંદરથી પ્રગટવા લાગે અને ધર્મ અનુભૂતિમાં આવવા લાગે.

જે વિનયવાન હોય તેના ચહેરા પર સદાય સ્મિત અને પ્રસન્નતા હોય. તેના problems ક્યાં અને કેવી રીતે solve થઈ જાય એની ખબર જ ન પડે. તેની વિપત્તિ દૂર થઈ જાય.

વિનય કર્મોનો ક્ષય કરવાનો સર્વોત્તમ ઉપાય છે.

ગુરુશરણે જ્યારે વ્યક્તિ અહંશૂન્ય થાય છે ત્યારે તેનામાં વિનય ગુણ પ્રગટ થાય છે. જ્યારે વિનય ગુણ પ્રગટ થાય છે ત્યારે જ ગુરુ સાથે connection થાય છે.

ગુરુ સાથેનું connection એટલે મોક્ષરૂપી ફળપ્રાપ્તિનું ઉત્તમ માધ્યમ અને ગુરુ સાથે connect થવાનું ઉત્તમ પરિબળ એટલે વિનય.

તમે કોઈ સંસ્થામાં, ધર્મ સ્થાનકમાં કે કોઈ missionમાં સેવા કરો છો, સેવા આપવા જાવ છો, તો તમારી દૃષ્ટિએ કદાચ 'સેવા' એક કાર્ય રૂપે હશે, પણ ખરેખર તમે સેવાનો અનુભવ કરશો તો તમને ખ્યાલ આવશે, તમે સેવા કરવા નથી જતાં, તમે તપ કરવા જાવ છો, તમે પ્રભુને પ્રેમ કરવા જાવ છો, પ્રભુની આજ્ઞાનું પાલન કરવા જાવ છો, તમારા કાર્યને પ્રેમ કરવા જાવ છો અને તમારો પ્રેમ છે એટલે જ સેવા થાય છે.

માનો કે, તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, તો એ વ્યક્તિનો સાથ, સંગાથ તમને ગમે કે કંટાળો આપે? એ જાય ત્યારે વિરહની વેદના થાય કે 'હાશ' થાય? તમને ન માત્ર ગમે પણ એના સાથમાં સમય ક્યાં પસાર થઈ જાય એ પણ ખબર ન પડે, કેટલાં કલાક વિતી ગયાં એ પણ ખબર ન પડે અને ઘડિયાળ સામે જોવાનું તો યાદ જ ન આવે! **એમ જે સેવાને પ્રેમ કરે એને સમયનું ભાન જ ન રહે.**

તમે જેને પ્રેમ કરતાં હો, એ દિવસમાં કેટલીવાર યાદ આવે અને સેવા તમને દિવસમાં કેટલીવાર યાદ આવે? જેટલીવાર સેવાને યાદ કરો છો, એટલો તમે સેવાને પ્રેમ કરો છો, એટલો તમે પ્રભુને પ્રેમ કરો છો. કેમ કે, સેવા એ પ્રભુ પ્રેમનો પર્યાય છે, સેવા કરવી એ પ્રભુની પ્રેરણા છે, પ્રભુની આજ્ઞા છે.

સેવામાં 'ભાવ' હોવા જોઈએ, સેવા 'ભાર' ન હોવી જોઈએ.

તમે જો સેવા દ્વારા પ્રભુ પ્રેમનો પ્રસાદ વહેંચતા હો તો તમારા હૃદયમાં કેવી હળવાશ હોય? જ્યાં સુધી હળવાશ ન હોય ત્યાં સુધી સેવા ન હોય! જે સેવા કરતાં હોય, જે પ્રભુ પ્રેમનો પ્રસાદ વહેંચતા હોય એના હૃદયમાં



પ્રેમભાવ હોય, કરૂણાભાવ હોય, સેવાભાવ હોય, 'ભાર' ન હોય. 'ભાર' ત્યારે જ આવે, જ્યારે સેવામાં અહમ્, આગ્રહ અને અધિકાર ભળી જાય. જ્યારે સેવામાં નિઃસ્વાર્થતા હોય, સેવા અપેક્ષારહિત હોય ત્યારે સેવામાં 'ભાવ' હોય!

સેવા કરનારના ચહેરા પર પ્રસન્નતાનો ભાવ હોય કે pressureનો ભાર હોય ?

ભાવનો એક નિયમ છે, સ્વીકાર! જ્યાં ભાવ હોય ત્યાં સ્વીકાર હોય, પછી એ પરિસ્થિતિનો હોય, સંજોગોનો હોય કે વ્યક્તિનો હોય! ભાવ એટલે સર્વ સ્વીકાર અને જ્યાં સર્વ સ્વીકાર હોય ત્યાં ક્યારેય થાક, કંટાળો કે હાશકારો ન હોય!

પ્રભુનો પ્રેમ, 'સેવા' જેની જીંદગીમાં હોય એની મુસ્કાન, એનું સ્મિત, એના ચહેરાની રૂપરેખા જ અલગ હોય, એની aura જ અલગ હોય, એનું વર્તુળ અલગ હોય. જે સેવા સાથે જોડાયેલાં હોય એને શીખવાનું કાંઈ ન હોય, છતાં ઘણું બધું આવડી જતું હોય. તમે તમારા કાર્યને પ્રેમ કરતા હો અને એ કાર્યમાં પ્રભુના દર્શન કરતાં હો તો એ અનુભવ કેવો હોય ?

તમને સેવા કરવાની તક મળી, એનો અર્થ એ જ છે કે, પ્રભુએ તમને પ્રેમનું card મોકલ્યું છે. એ cardના ભાવોને જે સમજી શકે છે, તેની સેવા સાર્થક હોય છે, તેને જ સેવાની એક-એક પ્રવૃત્તિમાં પ્રભુ પ્રેમનો અહેસાસ થાય છે.

સેવા એ જ હોય, જ્યાં નિતનવી વિવિધતા હોય, વિશિષ્ટતા હોય, જે તમારા સેવાના સત્કાર્યને નવી ઊંચાઈએ લઈ જતી હોય, તમારા કાર્યને નવું સ્વરૂપ આપતી હોય.

માનો કે એક 'મા' છે, તેની પાસે ત્રણ જ વસ્તુ છે, ઘી, ગોળ અને લોટ! તેને એક દીકરો છે, એ દીકરાને ખૂબ જ પ્રેમ કરે છે. તો એ શું કરશે? રોજ દીકરાને ઘીવાળી રોટલી અને ગોળ જમાડશે? ના! આ ત્રણ વસ્તુમાંથી જ રોજ એ એના માટે જુદી-જુદી વાનગી બનાવશે. ક્યારેક શીરો તો ક્યારેક સુખડી, ક્યારેક સક્કરપારા તો ક્યારેક માલપુવા!

એમ જે વ્યક્તિ એની સેવાને, એના કાર્યને, એના missionને પ્રેમ કરે છે એ રોજ કંઈક નવું - નવું સર્જન કરે છે.

સેવા ક્યારેય routine ન હોય.

પ્રભુ પ્રેમમાં ક્યારેય routine ન હોય અને routineમાં ક્યારેય પ્રભુ પ્રેમ ન હોય.

એટલે તમારી સેવામાં, તમારી સંસ્થાના વિકાસમાં, તમારા missionની પ્રગતિમાં કંઈક નવીનતા હોવી જોઈએ. કંઈક નવા વિચારો, નવા આયોજનો, જે નવી-નવી વ્યક્તિઓને પણ સેવાના સત્કાર્યમાં જોડાવા પ્રેરિત કરે.

સંસ્થા કે missionની સફળતા એ જ કહેવાય, તમારી સેવાની સાર્થકતા એ જ કહેવાય, જેમાં નવા ચાર આવે અને જૂના એક પણ જાય નહીં.

गुरु साहम्मिय सूस्सूणयाए णं भंते,
जीवे किं जणयइ ?
- श्री उत्तराध्ययन सूत्र (29/6)

गुरु अने साधर्मिकनी सेवा करवाथी शुंमणे ?
परमात्मा कडे छे :

गुरु अने साधर्मिकनी सेवा करवाथी विनय प्रतिरूपतानी प्राप्ति थाय छे. विनय प्रतिरूपता आवे त्यारे त्रीजा, पंढरमां के ते ज भवमां मोक्ष थाय छे. अेकवार विनय प्रतिरूपता आवी जाय अेटले मोक्ष नक्की ज ! जेने गुरु सेवामां, गुरु आज्ञामां आनंद आवे छे, तेनामां विनयभाव डोय छे, तेना प्रत्येक कार्यमां संवेदन डोय छे, तेना प्रत्येक कार्यमां प्रगति डोय छे. गुरुनी सेवा अेटले गुरु प्रत्येना प्रशंसाना भावने व्यक्त करवा. गुरुना गुणग्राम करवा !

प्रशंसा अे प्रचार छे. प्रशंसाथी प्रेरार्छेने कदाय कोर्ष बे-चार नास्तिक व्यक्ति, आस्तिक बनी जाय, कोर्ष धर्म तरफ वणी जाय, कोर्ष आत्म कल्याणना मार्गे आवी जाय तो तमने धर्म मणे, भगवान मणे अेवा पुण्य कर्म बंधाय जाय.

धर्मनी आराधना करवाथी कर्मोनी निर्जरा थाय छे ज्यारे देव-गुरु-धर्मनो प्रचार करवाथी,



कोर्षकने पमाडवाथी, भविष्यमां पामी शकीअे अेवा उच्य गोत्र पुण्यनो बंध थाय छे. कोर्षकने पमाडवुं अे ज पामवानुं कारण छे.

जेवी साधर्मिकनी सेवा, अेवी सुमति प्राप्त थाय. जेवी गुरुनी सेवा, अेवी सद्गति प्राप्त थाय.

ज्यारे व्यक्ति गुरु अने साधर्मिकनी सेवा करे छे, त्यारे अेना रूप अनुसार अेनी प्रतिरूप शैली डोय छे. अेटले के अे 'मा' ना रूपमां छे तो अेनी ज्वाणशैली 'मा' अनुसारनी डोय छे. ज्यारे प्रतिरूप शैली डोय त्यारे व्यक्ति दुर्गतिमां जती नथी. दुर्गति अेटले भगवान विनानो भव अने सद्गति अेटले भगवान साथेनो भव.

भगवान साथेनो भव मणवाथी शुं थाय ? भगवान साथेनो भव मणवाथी वारंवार भगवाननी अनुभूति थाय छे, जेने वारंवार भगवाननी अनुभूति थाय तेना दुर्गुणो घटे अने सद्गुणो वधे छे. सद्गुणो वधे छे अेटले आत्मशुद्धिनी दिशामां आगण वधे छे अने आत्मशुद्धि करतां-करतां अेक दिवस सिद्धत्वने पामे छे.

सेवा अे सिद्धत्व तरफ लर्ष जतो राजमार्ग छे.



श्री विरतीबेन डेलीवाणा - राजकोट

प्रबण पुरुषार्थ अने दंड आत्मविश्वास साथे

Chartered Accountantनी उच्य डीग्री प्राप्त करीने तमे संघ, समाज अने परिवारनुं गौरव वधार्युं छे.

ज्वाणना दरेक क्षेत्रोमां आवा ज प्रबण पुरुषार्थ साथे आगण वधीने तमारा योगोने परमार्थ माटेनो उपयोग बनावतां रडो अेवी जैनकांति परिवारनी मंगलभावना साथे अभिनंदन

अंतर
अभिनंदन



સ્વાધ્યાય એટલે સ્વનું, સ્વ વડે અધ્યયન.
સ્વાધ્યાય એટલે મારા આત્માના ક્યાં
ગુણોની આય થાય છે ને મારા ક્યાં ગુણોનો
વ્યય થાય છે ?

**આય ને વ્યયનું સ્વ માટે નિરીક્ષણ કરવું
એને કહેવાય છે સ્વાધ્યાય !**

મારામાં કેવા પ્રકારના ગુણો પ્રગટી શકે
એમ છે છતાં પ્રગટતા નથી, કેવા પ્રકારના
અવગુણો નીકળી શકે એમ છે છતાં નીકળતા
નથી તેનું અવલોકન કરવું તે સ્વાધ્યાય !
અથવા જેમ અરીસાની સામે વ્યક્તિ ઊભી રહે
અને પોતાની જાતનું નિરીક્ષણ કરે, ક્યાં ખોટ છે
ને ક્યાં ખૂબી છે એ જોઈ લે. તેવી રીતે સ્વનું
નિરીક્ષણ કરતાં-કરતાં પરમાત્માના શબ્દ,
પરમાત્માના આગમના અરીસાની અંદર સ્વને
જોતાં-જોતાં પોતાની ખામી અને ખૂબી બંનેને
નિહાળીને ખૂબીને વધારવાનો પ્રયત્ન કરે અને
ખામીને ઘટાડવાનો પ્રયત્ન કરે તે સ્વાધ્યાયી.

આત્મગુણોની આય કરાવે ને અવગુણોનો
ધીમે ધીમે વ્યય કરાવે, એને દૂર કરે, તે જ
સ્વાધ્યાય !

મારામાં શું આવી રહ્યું છે ને મારામાંથી શું
શું જઈ રહ્યું છે, એનું નિરીક્ષણ એને કહેવાય
પરમાત્માનો સ્વાધ્યાય.

જ્યારે આવા પ્રકારનો સ્વાધ્યાય થાય
ત્યારે શું થાય ?

ત્યારે ભગવાને આખો મોક્ષનો માર્ગ
બતાવી દીધો. જેમ -જેમ પોતે પોતાનું નિરીક્ષણ
કરે, અવગુણ વધે છે કે ઘટે છે તે જુએ, એટલે તે
જોવા માટેની દૃષ્ટિ ખીલે.

મોટાભાગે વ્યક્તિની દૃષ્ટિ ખીલતી નથી

કારણ કે, પોતાનો દોષ એ જોતો નથી અને
બીજાના દોષ જોયા વગર એ રહેતો નથી. જેમ-
જેમ એ સ્વાધ્યાય કરવા લાગે તેમ-તેમ એનું
ધ્યાન બીજા પરથી ઘટવા લાગે. પોતાના પર
ધ્યાન વધવા લાગે એટલે શું થાય ? પોતાને
સુધારવાનું મન થાય. એટલે ધીમે-ધીમે એની
જ્ઞાનદૃષ્ટિ ખૂલે. જ્ઞાન ખૂલે એટલે એનો મોહ ઘટે.
મોહ ઘટે એટલે મોહનીય કર્મ ખપે. મોહનીય કર્મ

નાનકડા છોડને ક્યારે પ્રાણી ખાઈ જાય એ નક્કી
ન કહેવાય ! વૃક્ષ થડ શું કામ બનાવે છે ?
પ્રાણીઓની પહોંચની બહાર નીકળવા માટે.

એવી જ રીતે જ્યારે આત્મા સમર્પણતાના
મૂળિયાં ધરાવે છે એની સાથે સાથે સ્વાધ્યાયનું
થડ ધરાવે છે, ત્યારે પર રૂપી પ્રાણી તેને ખાઈ
શકતું નથી.

જેટલા જેટલા સારા ચિંતનકારો કે સારા



ખપે એટલે અંતરાય કર્મ ખપે. અંતરાય કર્મ ખપે
એટલે જ્ઞાનાવરણીય ને દર્શનાવરણીય બંને કર્મો
ખપી અને સીધું કેવળજ્ઞાન થઈ જાય.

**સ્વાધ્યાય એટલે મોક્ષરૂપી ફળ
મેળવવાનું થડ રહેલું છે.**

**મૂળ વિનય છે તો થડ સમાન સ્વાધ્યાય
રહેલું છે.**

સ્વાધ્યાયના થડ ઉપર જ સાધનારૂપી બધી
ડાળીઓ ટકી શકે છે. માત્ર મૂળ હોય ને સીધા
પાંદડા આપી દો. શું થાય ?

જે વૃક્ષને થડ ન હોય અને મૂળમાંથી સીધી
ડાળીઓને પાંદડા આવવા લાગે તો થાય શું ?
જમીન પર પથરાયેલી કોઈ વેલને કે કોઈ

સ્વાધ્યાયકારો છે તેના જીવનમાં સહજતાથી
કોઈ પ્રાણી પ્રવેશ નહીં કરી શકે.

સાચા થડવાળી વ્યક્તિ હશે તેના
આત્માના ગુણો કોઈ ચાવી નહીં જાય. એ તરત
એવી જાતનો વ્યવહાર નહીં કરી બેસે. થડ જેવું
જે કામ કરે તેને મોક્ષમાર્ગનો સ્વાધ્યાય
કહેવાય છે.

આપણને મોક્ષરૂપી ફળ જોઈતું હશે તો
સમર્પણતા અને વિનયનાં મૂળ જોઈશે અને મૂળ
પછી સ્વાધ્યાયનું થડ જોઈશે. જેની પાસે મૂળ છે
પણ થડ નથી એ પણ ટકતા નથી અને મૂળિયા
વગરનું થડ કોઈ દિવસ હોતું નથી. હા, કલમ
જોઈ શકાય પણ કલમનો વિકાસ હોતો નથી.



સિદ્ધતાં અંશ બનવાનું ૧૫ ધ્યાન

ધ્યાન આત્મ સાધનાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. જે આત્મ શુદ્ધિ કરાવી 'સ્વ'ની સમીપ લઇ જાય. અનંત તીર્થકરો જે સિદ્ધત્વ સુધી પહોંચ્યા એમાં એમની ધ્યાન સાધના એક અગત્યનું પરિબળ હતી.

આમ ધ્યાન ક્યારે થાય ?

જ્યારે અંતરમાં કંઇક પામવાનું, કંઇક કરવાનું અને કંઇક અનુભવવાનું ધ્યેય હોય. એક લક્ષ સુધી પહોંચવાના ઉત્કૃષ્ટ ભાવ હોય. દઢ મનોબળ હોય અને 'હું કરીશ,' એવો આત્મ વિશ્વાસ હોય.

ધ્યાન એ સંસારથી **disconnect** થઇ પરમાત્મા સાથે connect થવાની process છે.

ભગવાને કહ્યું, જડવત્ અવસ્થા એ ધ્યાનની પ્રારંભ ક્ષણો છે. જે હું નથી, તેને હું, હું માનું છું, એટલે તે active થાય છે. જડ પાસે પોતાની active થવાની capacity નથી. ચૈતન્ય વગર જડ દેહ ક્યારેય active થતું નથી. જડ જો જડવત્ થઇ જાય તો ચૈતન્ય, પણ ચૈતન્યવત્ થઇ જાય. જડ અને ચેતનનું ભેદજ્ઞાન થઇ જાય તો, એ અનુભૂતિમાં આવી જાય, જે જેવું છે તે તેના સ્વરૂપમાં રહે, જડ શરીર એના ભાવમાં રહે અને ચૈતન્ય રૂપ આત્મા આત્મભાવમાં રમણ કરે.

એકરૂપતાના અજ્ઞાનને દૂર કરવા માટે છે ધ્યાનની સાધના !

ધ્યાન આપણને disconnect કરે છે, શરીરથી પણ અને અજ્ઞાનથી પણ! જ્યારે શરીરથી disconnect થયેલી અવસ્થા અનુભવમાં આવે તો automatically શરીર સાથે એકરૂપતા એ મારું અજ્ઞાન હતું તે વાતનો છેદ ઊડી જાય.

ધ્યાન સાધના શું કરશે ?

ધ્યાન સાધના ધીમે-ધીમે દેહ અને આત્માની એકાત્મકતા રૂપ મિથ્યાત્વને દૂર કરશે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરાવશે. દેહ અને આત્મા એક છે એવા ભ્રમને તોડશે.

આત્મા જ્યારે આત્માને અનુભવવા લાગે, ત્યારે જ આત્મિક પરિવર્તન આવે.

ધ્યાનથી negativity દૂર થાય છે.

ધ્યાનથી મનની ચંચળતા શાંત થાય છે.

ધ્યાનની સાથે જો જ્ઞાન હોય, સમજ હોય તો ધ્યાનરૂપી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે.

ધ્યાન દ્વારા થતી વ્યર્થતાની અનુભૂતિના કારણે રાગ, મોહ, wrong identity, મિથ્યાત્વ બધું જ છૂટતું જાય છે.

ધ્યાનથી તમારું કર્તાપણું zero થઇ જાય. કર્તાપણું zero થાય એટલે activeness મંદ પડવા લાગે. પછી ધ્યાનની બહાર જ પ્રવૃત્તિ થાય એમાં જાગૃતિ ભળે એટલે ભળવાપણું ઓછું થઇ જાય. ધ્યાન એક જ એવી process છે જેમાં વ્યક્તિ પૂર્ણપણે સમ્યક્ દર્શન પ્રાપ્ત કરી શકે છે. Right Identity, realize કરી શકે છે, પોતાના આત્માને પામી શકે છે.

ધ્યાન મન, વચન, કાયાના યોગોને મંદ પાડે છે, જેથી કર્મબંધ ઓછા થઇ જાય છે.

ધ્યાનથી વ્યક્તિનો આલંબનભાવ ઘટવા લાગે છે, એની dependency ઘટવા લાગે છે.

ધ્યાનની સ્થિરતા જગતની વાસ્તવિકતા સમજાવે છે.

'કાંઈ ન કરવું તે ધ્યાન છે!' કેમ કે, કાંઈ પણ કરવું એ action હોય છે. જ્યાં actions હોય ત્યાં reactions હોય. જ્યાં reactions હોય ત્યાં કર્મબંધન હોય અને જ્યાં કર્મબંધન હોય ત્યાં સંસાર હોય.

જ્યાં activeness છે ત્યાં પરમાણુઓ, પુદ્ગલો, વિચારો, કર્મો બધાં જ attach થવાના છે.

તમે જેવા active થવાનું બંધ કર્યું, એટલે કર્મો, વિચારો, વિકારો બધાં સમજી જશે અહીંયા આપણું કાંઈ ચાલવાનું નથી એટલે બધી વૃત્તિઓ પણ શાંત થઇ જશે. ધીમે ધીમે તમે બધાંથી disconnect થવા લાગશો. જે દિવસે આત્માની ઉપરના કર્મોના બધાં જ layers દૂર થઇ જશે. આત્માની શુદ્ધ અવસ્થાનો અલૌકિક અનુભવ અનુભવાશે, ત્યારે જે પ્રભુ મહાવીર પામ્યા તે જ તમે પામી શકશો, એ જ કેવળજ્ઞાન અને કેવળદર્શન !

કાઉસગ્ગ એટલે જાણતાં-અજાણતાં થયેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત.

કાઉસગ્ગ - વિસોદી કરણેશં - આત્માની વિશુદ્ધિ કરાવે છે.

કાઉસગ્ગ - વિસલ્વી કરણેશં - શલ્યને કાઢવા માટે કાઉસગ્ગ હોય છે. કાઉસગ્ગ એ કાંટાને કાઢવા માટે છે. શલ્ય એટલે શું? કાંટા એટલે શું? કોઈ વ્યક્તિના વચનનો કાંટો વાગી ગયો હોય, તો કોઈના વર્તનનો કાંટો વાગી ગયો, જે આપણને આપણી સ્મૃતિમાં વારંવાર ખૂંચ્યા કરતો હોય એને શલ્ય કહેવાય છે.

જે વ્યક્તિ ભાવથી કાઉસગ્ગ કરે છે તેની એ કાંટા વાગી ગયાની સ્મૃતિ delete થઈ જાય છે.


માનો કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે, વારંવાર તેની યાદ આવે છે, તેણે કહેલાં વચનો યાદ આવે છે, તેણે કરેલું વર્તન યાદ આવે છે અને તમને ખૂંચ્યા કરે છે અને એના માટેની negativity વધતી જાય છે.

તમે રોજના 108 લોગસ્સના કાઉસગ્ગ કરવાનું શરૂ કરી દો. તમે જોજો કે બે-ત્રણ મહિના થશે પછી તમને તે વ્યક્તિ કે તેનું વચન અને વર્તન યાદ જ નહીં આવે.

અને કદાચ વર્ષો પછી અચાનક ક્યાંક સામે આવી જશે ત્યારે તમને થશે કે પહેલાં તો મને આના પ્રત્યે કેટલો અણગમો હતો, કેટલો negative ભાવ હતો અને હવે તો કંઈ જ નથી. આ છે કાઉસગ્ગનો પ્રભાવ.

કોઈએ ભગવાનને પૂછ્યું, 'ભગવાન! તમે ભગવાન કેવી રીતે બન્યા?'

ભગવાને કહ્યું, 'હું ભગવાન એટલે જ બન્યો છું કેમ કે, જેમણે-જેમણે મને દુઃખ



આપ્યાં, હેરાન કર્યો, ઉપસર્ગ આપ્યા તે બધાને હું ભૂલી ગયો છું.'

'પણ ભગવાન! તમે તે બધાને ભૂલ્યા કેવી રીતે? ગોવાળે તમારા કાનમાં ખીલા માર્યા, સંગમદેવે તો આટલા-આટલા ઉપસર્ગો આપ્યા. ભગવાન! તમે તેમને ભૂલી કેવી રીતે શક્યા?'

આ સાંભળી ભગવાને કહ્યું, 'હું મારો વધારેમાં વધારે સમય કાઉસગ્ગમાં વિતાવું છું. કાઉસગ્ગને કારણે જ હું મારો આખો ભૂતકાળ ભૂલી શક્યો, મારા આખા ભૂતકાળને ભૂંસી શક્યો. મારી બધી જ bad memoriesને delete કરી શક્યો અને હું વર્તમાનમાં જીવી શક્યો. આ બધું શક્ય થઈ શકે માટે જ મેં વારંવાર-વારંવાર કાઉસગ્ગ કર્યો.'

જો તમારે પણ તમારી અંદરમાં રહેલી કાળા કોલસા જેવી bad memoriesને delete કરવી હોય તો વારંવાર કાઉસગ્ગ કરવાની practice કરો.

પાવાણાં, કમ્માણાં, નિગ્ધાયણાહ્યાએ. તમારા ગમે એવા પાપની ઘાત કરી શકે એવું બળ કાઉસગ્ગમાં છે.

અમે કેટલાય એવા cancerના દર્દીઓને કાઉસગ્ગની આરાધના કરાવી છે અને તેમને 99% દર્દમાંથી નિવૃત્તિ મળી ગઈ છે. કેમ કે, પ્રભુવચનો પર અમને શ્રદ્ધા છે.

બીજી વાત, કાઉસગ્ગ કરવાથી બહારની ઇન્દ્રિયો શૂન્ય થાય છે એટલે અંદરનું જ્ઞાન પ્રગટ થવા લાગે છે. કાઉસગ્ગ કરવાથી બહારનાં connectionsથી disconnect થવાય છે એટલે આત્મિક connection શરૂ થઈ જાય છે.

પણ એ માટે કાઉસગ્ગના મહત્વની ખબર હોવી જોઈએ.

અલ્પકાળ માટે સંસાર અને સંબંધોને છોડવા એને કાઉસગ્ગ કહેવાય અને દીર્ઘકાળ માટે છોડવા એને સંયમ કહેવાય.

જ્યારે તમે કાઉસગ્ગ કરતા હો ત્યારે તમે કોઈની લાગણી, પ્રેમ, સ્નેહ કે સંબંધને જાળવી શકો? એટલા સમય માટે, એ કાળ માટે ન જાળવી શકો. એ સમયે તમે tv જોઈ શકો? એ સમયે તમે કંઈ ખાઈ શકો? એ સમયે તમે વાહનનો ઉપયોગ કરી શકો? ના.

માટે જ, જ્યારે તમે કાઉસગ્ગ કરો છો ત્યારે એ અલ્પ સમય માટે તમે સંસારથી disconnect થઈ જાવ છો.

કાઉસગ્ગ એટલે અલ્પ સમય માટે સંસાર છોડવો. માટે જ કાઉસગ્ગને સંયમનું sample કહેવાય છે.

જેમ-જેમ વ્યક્તિ પોતાની કાયાને કાઉસગ્ગમાં સ્થિર કરે છે તેમ-તેમ તેની aurasનું સ્નાન થવા લાગે છે.

ધન ધન તપકૈસરી મુનિવરા...

વર્ષ 2017 પાવનધામ કાંદિવલીના આંગણે દીક્ષા જીવનનું હજી તો બીજું જ ચાતુર્માસ વ્યતીત થઈ રહ્યું હતું. પરમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની આજ્ઞાથી શ્રી અંતગડ સૂત્ર આગમ ગ્રંથ વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગુરુની દરેક આજ્ઞા સમર્પિત શિષ્ય માટે 'મમ લાભોત્તિ પેહાણ' માત્ર ને માત્ર આત્મહિત અને લાભનું કારણ બને છે. શ્રી અંતગડ સૂત્રમાં વર્ણવવામાં આવેલી અનેક પ્રકારની સુદીર્ઘ તપશ્ચર્યાઓ વાંચતા જ અંતરમાંથી ભાવ ઉદ્ભવ્યા, "અહો ! કેવી-કેવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરીને પૂર્વના મહાન આત્માઓ પોતાનું કલ્યાણ સાધી ગયા". આ વિચાર સાથે જ 19માં તીર્થંકર પ્રભુ મલ્લીનાથ ભગવાને પૂર્વના મહાબલ મુનિના ભવમાં કરેલી અજોડ એવી 'લઘુસિંહનિષ્કીડિત તપ'ની આરાધના કરવાના ભાવ જાગ્યા. અને 2017ની તે ધન્ય ઘડી, ધન્ય પળે મન સંકલ્પબદ્ધ થયું કે, સુયોગ્ય સમયે આ સુદીર્ઘ તપશ્ચર્યાની આરાધના કરવી જ છે.

માત્ર દોઢ વર્ષની દીક્ષા પર્યાયમાં 24 વર્ષના યુવાન સંત પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબે કરેલો આ પરમ કલ્યાણકારી સંકલ્પ ગુરુકૃપાથી સાકાર થયો 2021માં પરમધામ સાધના સંકુલની ભૂમિ પર અને ગુરુકૃપાએ

તપોત્સવ

નિર્વિઘ્ને એમણે 187 દિવસના સમયગાળામાં માત્ર 33 દિવસના પારણા અને 154 દિવસના ઉપવાસ સાથેની આ મહાતપની અજોડ આરાધના દરરોજની માત્ર 4 કલાકની નિદ્રા સાથે પરિપૂર્ણ કરી.

અને આવા મહાન તપની અનુમોદનાએ સમસ્ત બોરીવલી, કાંદિવલી, મલાડ શ્રી સંઘોના ઉપક્રમે પાવનધામના આંગણે તેમજ સમસ્ત ઘાટકોપરના સાત શ્રી સંઘોના ઉપક્રમે ઘાટકોપરમાં દિવસો સુધી યોજાયો હતો ત્યાગ પ્રેરણાનો મહા મહોત્સવ-તપોત્સવ !

આલેખિત થયા તપોત્સવના આમંત્રણ



પારસધામ- ઘાટકોપરના આંગણે પરમ ગુરુદેવના સાંનિધ્યે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં લુક એન લર્નના નાના નાના બાળકો અને યુવાનો દ્વારા સિદ્ધ પરમાત્મા, અરિહંત પરમાત્મા, ઉપકારી ગુરુવર્યો અને દરેક ઉપકારી તત્ત્વને તપોત્સવમાં પધારવા કેસર છાંટણે આમંત્રણ પત્રિકાના આલેખન કરવામાં આવ્યા હતા.



...સિંહ બનીને ગર્જવાનું સત્વ જાગી ગયું...



સમસ્ત બોરીવલી, ઠાંદિવલી, મલાડના શ્રી સંઘોના ઉપહ્રમે પાવનધામના આંગણે દિવસો સુધી યોજાયો ત્યાગ પ્રેરણાનો મહા મહોત્સવ

**ભક્તિભીની ભાવનાએ
પાવનધામમાં પ્રવેશ વધામણા**

તપોત્સવ અર્થે પાવનધામના આંગણે પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ તેમજ પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબનું પાવનધામના ભાવિકો, લુક એન લર્નના દીદી, અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો આદિ દ્વારા અત્યંત ભક્તિભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

**પાવનધામમાં પધાર્યા
વિવિધ પંથના સંત સતીજીઓ:**

પૂજ્ય તપસ્વી મુનિરાજે કરેલી કઠોર

તપોત્સવ

તપશ્ચર્યાની અનુમોદના કરવાના ભાવ સાથે મૂર્તિપૂજક સંપ્રદાયના મહાતપસ્વી આચાર્ય પૂજ્ય શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ, આદિ અનેક પૂજનીય સંત-સતીજીઓ પાવનધામ પધારતા તપધર્મની અનેરી મહિમા પ્રસરાઈ હતી.

**તપ ગૌરવ ગાથા,
તપ અનુમોદના યાત્રા:**

જન-જનના હૃદયમાં તપધર્મ અને તપસ્વી

આત્મા પ્રત્યે અહોભાવ અને પૂજ્યભાવને જાગૃત કરતી, અનેક પ્રકારની વિવિધતાઓથી શોભતી, જયકાર ગુંજવતી ભવ્યાતિભવ્ય ત્રણ-ત્રણ અનુમોદના યાત્રા અનન્ય ગુરુભક્ત શ્રી પ્રદીપભાઈ મહેતા અને માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી - બાદશાહ પરિવાર તથા પટેલ પરિવારના માતુશ્રી ઉષાબેન પટેલ અને શ્રી કુંદનબેન પારેખ - શ્રી પૂર્વીબેન કેતનભાઈ પટેલના આંગણેથી અનુમોદના યાત્રાનો લાભ લેવામાં આવતા અજૈન ભાવિકોના હૃદયમાં પણ જિનશાસન પ્રત્યેની અહોભાવનાના અનન્ય દર્શન થયા હતા.



(1) આચાર્ય ભગવંત અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ સાથે અનેક મુનિવરોથી શોભતો તપોત્સવનો દરબાર (2-3) અનુમોદના યાત્રાના પ્રારંભે વંદિત થઈ રહ્યાં પરમ ગુરુદેવ અને તપકેસરી મુનિરાજ (4-5) તપધર્મના સિંહનાદ સાથે ત્યાગધર્મની ધ્વજા-પતાકા લહેરાવતી તપકેસરી મુનિરાજની અનુમોદના યાત્રા (6) સહવર્તી મુનિવરોએ ઊંચકેલી ભવ્ય શિબિકામાં બિરાજમાન થઈને પધારી રહ્યાં તપકેસરી મુનિરાજ.



તપસ્યા કે સમસ્યા ?

The talk show:

અનેક જિજ્ઞાસુ youngstersના મનમાં ઉઠતા તપસ્યા સંબંધી પ્રશ્નોના તપસ્વી મુનિરાજ દ્વારા આપવામાં આવેલા logical સમાધાન સાથેનો આ talk show સહુ માટે પ્રેરણાત્મક બન્યો હતો.

"તપ - The inner strength"

નાટ્ય પ્રસ્તુતિ:

જૈન દર્શનના ગૌરવવંતા પાત્રો- આયંબિલ આરાધક સુંદરીજી અને તપસ્વી ચંપા શ્રાવિકાના જીવન પ્રસંગોને તાદૃશ્ય કરતી શ્રી સચિનભાઈ શાહ નિર્મિત, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય લિખિત અને શ્રી પંકજભાઈ ત્રિવેદી અને શ્રી શૈલેજા શુક્લા દ્વારા દિગ્દર્શિત તપ ધર્મની મહિમા, ગરિમા અને તપના scientific ફાયદાઓ સમજાવતી નાટિકા ઉપસ્થિત સહુ માટે પ્રેરણાદાયી બની ગઈ હતી.

ડુંગર દરબારે તપોત્સવ:

આઠ-આઠ દિવસ સુધી અત્ર-તત્ર-સર્વત્ર ગુંજી રહેલા તપોત્સવના અંતિમ દિવસે ડુંગર દરબારના ખીચોખીચ ભરાયેલા વિશાળ શામિયાણામાં તપસ્વી મુનિરાજને સુંદર શિબિકામાં બિરાજમાન કરાવીને સહવર્તી પૂજ્ય ચાર સંતો અને શ્રાવકોએ ખંભા પર શિબિકા ઉચકીને પ્રવેશ વધામણા કર્યા હતા. સ્વયં પરમ ગુરુદેવ દ્વારા તપસ્વી શિષ્યને સ્નેહ અને વાત્સલ્યથી આવકારતા દ્રશ્યો સહુ માટે વંદનીય બન્યા હતા.

પાવન ઉપસ્થિતિ:

તપસ્વી મુનિરાજની તપ અનુમોદના

અવસરે મુંબઈમાં બિરાજમાન લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂજ્ય શ્રી ભાસ્કરજી સ્વામી આદિ 9 સંતો, ગોંડલ સંપ્રદાયના ડો. પૂજ્ય શ્રી તરૂલતાભાઈ મહાસતીજી, વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીભાઈ મહાસતીજી આદિ 70 સાધ્વીજી, બોટાદ સંપ્રદાયના પૂજ્ય શ્રી વંદનાભાઈ મહાસતીજી આદિ, લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજ્ય શ્રી શાશ્વતીભાઈ મહાસતીજી આદિ ઠાણા, લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજ્ય શ્રી નિમગ્નાજી મહાસતીજી આદિ મળીને 100થી વધારે સંત-સતીજીઓની મંગલ ઉપસ્થિતિ ઉપરાંત બોરીવલી વિસ્તારના સાંસદ શ્રી ગોપાલભાઈ શેટ્ટી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ અનેક ક્ષેત્રોના 10,000થી વધુ ભાવિકો, લાઈવના માધ્યમે દેશ-વિદેશના લાખો ભાવિકોએ જોડાઈને ભાવભીની અનુમોદના કરી જીવનને ધન્ય બનાવ્યું હતું.

ઇશુ જળની અર્પણતા:

તપસ્વી મુનિરાજને પારણું કરાવવા ઝંખી રહેલા હજારો-હજારો ભાવિકોએ ઘરેથી લાવેલા ઇશુ જળને પૂજ્ય સંતો તેમજ મહાસતીજીઓના પાત્રમાં વહોરાવ્યું હતું, જેના દ્વારા તપસ્વી મુનિરાજને પારણાં કરાવવામાં આવ્યા હતા.

તપોત્સવ બન્યો સંકલ્પોત્સવ:

જૈન ધર્મનું ગૌરવ અકબંધ જાળવી રાખવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાને સહર્ષ જીલતા એક સાથે ઉપસ્થિત 3000થી વધુ પરિવારોએ હોટલ કે restaurantમાં કદી પણ કંદમૂળ કે non-Jain food ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દેહને ગાળી,

ઓગાળી, પીગળાવી દે

તેવી તપશ્ચર્યા

કરનારા તપસ્વી મહાત્

તપોત્સવ બન્યો અભયદાનોત્સવ:

એ સાથે જ તપસ્વી મુનિરાજને શાલ અર્પણ કરવાના લાભ સ્વરૂપ શાસનદીપક ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ્ મા સ્વામી પૂજ્ય શ્રી જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા 1 કરોડ, 11 લાખનું અનુદાન, માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર દ્વારા રૂપિયા 51 લાખનું અનુદાન અને અનેક ઉદાર હૃદયા ભાવિકોએ અર્પણ કરેલા બહોળા અનુદાન મળીને રૂ. 3 કરોડના અનુદાન ગૌશાળા અને પાંજરાપોળના અબોલ જીવો માટે જાહેર કરવામાં આવતા આ તપોત્સવ અભયદાનનો મહોત્સવ બન્યો હતો.

તપસ્વીની અનુમોદના તપશ્ચર્યાથી:

તપસ્વી મુનિરાજની દીર્ઘ તપશ્ચર્યાની અનુમોદના કરતા 350થી વધારે ભાવિકોએ તપોત્સવ દરમિયાન અક્રમ તપની આરાધના કરીને સોનામાં સુગંધ ભેળવી હતી.

તપકેસરી પદના કેસરિયા:

ગોંડલ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં કોઈએ ન કરી હોય એવી અજોડ



(1-2) 'तपस्या के समस्या ?' Talk Showમાં तपकेसरीने प्रश्न करी रहां जिज्ञासु युवान साथे तपस्वीनो जय-जयकार गुंजवी रहां भाविको (3) तप-The inner strength नाटिकानुं भाववाही दृश्य (4-5) लाभार्थी भाविको द्वारा शाल अर्पण.

તપશ્ચર્યા કરનારા પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબને ગોંડલ સંપ્રદાય દ્વારા 'તપકેસરી'નું ગૌરવવંતુ પદ અર્પણ કરવામાં આવતાં જયઘોષ ગૂંજી ઊઠ્યો હતો.

વ્હાલની શાલ:

શ્રી લીંબડી અજરામર સંપ્રદાય તરફથી આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના હસ્તે તપકેસરી મુનિરાજને તેમજ પરમ ગુરુદેવને શાલ અર્પણ કરવામાં આવી હતી. એ સાથે જ ગોંડલ સંપ્રદાયના સાધ્વીવૃંદ, બોરીવલી-કાંદિવલી-મલાડના શ્રી સંઘો તરફથી શાલ અર્પણ કરવામાં આવી હતી. મૂર્તિપૂજક સંપ્રદાયના શ્રી ધવલભાઈ વોરા અને 25 સંઘો તરફથી તપકેસરી મુનિરાજને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

તપકેસરીની અંતર અભિવ્યક્તિ:

'મારી જીવન નૈયાના સુકાની હે ગુરુદેવ! આપના ચરણ કમળમાં જીવનભર આવી તપશ્ચર્યાના ફુલો ધરતો રહું અને મારા કર્મોને ક્ષય કરતા કરતા આપને મારા ભારથી મુક્ત કરતો રહું એ જ અંતરની ભાવના છે' ગુરુ સમર્પણતાના આવા ઉત્કૃષ્ટ ભાવને પ્રગટ કરનારા તપકેસરી મુનિરાજના વચનો હૃદયસ્પર્શી બન્યા હતા.

અહોદાનમ્ પારણા:

છ-છ મહિનાની કઠોર તપશ્ચર્યા બાદ ઉપસ્થિત આચાર્ય ભગવંત, સંતો અને સાધ્વીવૃંદ દ્વારા તપકેસરી મુનિરાજને પારણાં કરાવવામાં આવતા હર્ષ અને આનંદ ચોમેર છવાયા હતા.

અદકેરા સન્માન લાભાર્થી પરિવારના:

તપકેસરી મુનિરાજ જેવા પુત્રરત્નને જન્મ આપનારા માતા-પિતા શ્રી રૂપલબેન હેમલભાઈ દોશી, સમગ્ર તપોત્સવના લાભાર્થી માતૃશ્રી તારાબેન ચુનીલાલ મોદી - બાદશાહ પરિવાર, તપોત્સવના વિશાળ મંડપના લાભાર્થી માતૃશ્રી ઊર્મિલાબેન શાહ-શ્રી SK પરિવાર, તપોત્સવમાં પધારવા માટે સેંકડો ભાવિકો માટેની બસ વ્યવસ્થાના લાભાર્થી શ્રી માલતીબેન કોઠારી પરિવાર, તેમજ અનુમોદના યાત્રાના લાભાર્થી શ્રી કેતનભાઈ પટેલ પરિવાર અને પ્રદીપભાઈ શાહ પરિવારના બહુમૂલ્ય સન્માન શ્રી ચંદ્રકાંતભાઈ ગોસલીયા, શ્રી હિતેશભાઈ મહેતા આદિના હસ્તે કરવામાં આવ્યું હતું.

સાધર્મિક સહાય:

તપોત્સવ નિમિત્તે પોતાને જરૂરિયાતમંદ સાધર્મિક માનતા હોય તેવા 2000 સાધર્મિક

તપોત્સવનો અવસર
popularity માટે નહીં,
સંહુની purity
વધારવા માટે હોય છે.


પરિવારો માટે જીવન આવશ્યક અન્ન-સામગ્રીની કીટ અર્પણ કરવામાં આવી હતી.

અક્ષર અભિવ્યક્તિએ
અનુમોદના:

વિવિધ પંથ અને સંપ્રદાયના અનેક આચાર્ય ભગવંતો અને પૂજ્ય મહારાજ સાહેબ-મહાસતીજીઓએ પત્ર દ્વારા તપકેસરી મુનિરાજની અનુમોદના કરી હતી.

USAના ડોક્ટરની અનુમોદના:

Water fastingના માધ્યમે અનેક દર્દીઓની સારવાર કરી રહેલા અમેરિકાના True North Healing Centreના founder Dr. શ્રી એલિન ગોલ્ડહેમર એ તપસ્વી મુનિરાજ સાથે zoom meetingના માધ્યમે વાર્તાલાપ કરીને જિનશાસન, તપધર્મ અને તપકેસરી મુનિરાજ પ્રત્યે અત્યંત અહોભાવ પ્રગટ કરીને અનુમોદના કરી હતી.



મનુષ્ય ભવ એ સુખનો ભવ નથી, પણ શુદ્ધિનો ભવ છે,
સુખના ભવ અંતે સંસારમાં અનંતભવ કરાવે છે,
જ્યારે શુદ્ધિનો ભવ અંતે સંસારથી મુક્તિ અપાવે છે.

આત્મશુદ્ધિમાં 'તપ' એ પરમ નિમિત્ત છે



(1) તપોત્સવની અનુમોદના કરી રહ્યો વિશાળ જનસમુદાય (2) આશીર્વચન ફરમાવી રહ્યાં આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી (3) તપકેસરીને વ્હાલની શાલ અર્પણ કરી રહ્યાં પૂજ્ય આચાર્ય ભગવંત (4) ભાવ અભિવ્યક્તિ કરી રહ્યાં તપકેસરી મુનિરાજ (5) મૂર્તિપૂજક સંપ્રદાયના શ્રીસંઘો તપકેસરી મુનિરાજને અર્પણ કરી રહ્યાં સન્માન પત્ર (6) તપકેસરીના જન્મદાતા શ્રી રૂપલબેન અને હેમલભાઈને સન્માનિત કરી રહ્યાં પાવનધામના પદાધિકારીઓ.

...આ કાળમાં લઘુસિંહનિષ્ક્રીડિત તપ કરનારા તપ કેસરી મહાન...



તપોત્સવના તરંગોએ ધન્ય બન્યું ઘાટકોપર

187 દિવસની આરાધનામાં 152 ઉપવાસની આરાધના પરિપૂર્ણ થઇ હતી અને બોરીવલી, કાંદિવલી, મલાડ સંઘોના ઉપક્રમે ભવ્યાતિભવ્ય પારણા મહોત્સવ - તપોત્સવ ઊજવાઈ ગયો હતો. પરંતુ પુરુષાર્થ હજી બાકી હતો. 154 ઉપવાસની પૂર્ણતા કરવા માટે હજી 2 ઉપવાસની આરાધના બાકી હતી જેનો પારણા મહોત્સવ - તપોત્સવ ઊજવાયો ઘાટકોપરના શ્રી હિંગવાલા લેન સંઘ, શ્રી કામાગલી સંઘ, શ્રી સ્વાધ્યાય સંઘ, શ્રી ગારોડિયાનગર સંઘ, શ્રી પંતનગર સંઘ, શ્રી રાજાવાડી સંઘ અને શ્રી પારસધામ સંઘ-આ સાત-સાત શ્રી સંઘોના ઉપક્રમે ઘાટકોપરમાં.

અનુમોદના યાત્રાએ ગુંજ્યા ઘાટકોપરના માર્ગ:

શ્રી કામાગલી સ્થાનકવાસી જૈન સંઘના આંગણેથી અને શ્રી ઉર્વીશભાઈ વોરાના આંગણેથી પ્રારંભ થયેલી તપ અનુમોદના યાત્રાએ ઘાટકોપરના રાજમાર્ગી પર તપકેસરી મુનિરાજનો જયઘોષ ગુંજાવ્યો હતો.

અંતરભાવની શુભેચ્છા:

તપકેસરી મુનિરાજને Thank you કહેતા છ કાયના જીવોના સ્વરૂપમાં લુક એન લર્નના બાળકોની પ્રસ્તુતિ સાથે જ પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી બિન્દુબાઇ મહાસતીજી તેમજ કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના પૂજ્ય શ્રી કોકિલાબાઇ

મહાસતીજીએ તપકેસરીના પુરુષાર્થની પ્રશસ્તિ કરીને શુભેચ્છા અર્પણ કરી હતી.

ગ્રંથ વિમોચન:

સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના સંયમ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ અવસરે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ બરવાળીયા દ્વારા સર્જિત

'પ્રાણ શિષ્ય શ્રુત સંપદા' ગ્રંથ તેમજ શ્રી અશોકભાઈ ઠોસાણીની પ્રથમ પુણ્યસ્મૃતિ નિમિત્તે 'શરણમ' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

તપોત્સવમાં ભવ્યો સંયમ સુવર્ણ મહોત્સવ:

શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલા લેનના આંગણે અધ્યાત્મયોગિની પૂજ્ય બાપજી શ્રી લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ડો. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મહાસતીજીના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી મીરાબાઈ મહાસતીજીની પચાસમી દીક્ષા જયંતિ નિમિત્તે સંયમ સુવર્ણ મહોત્સવ યોજાયો હતો.

સંયમીની સંયમ શુભેચ્છા:

ડૉ. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મ. આદિ, વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મ. આદિ, અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય આદિ અનેક સંત-સતીજીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અવસરે પરમ ગુરુદેવે પૂજ્ય શ્રી મીરાબાઈ મહાસતીજીને સેવાભાવી આત્મા સ્વરૂપે ઓળખાવવા સાથે ડો. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી જશુબાઈ મહાસતીજી, ડો. પૂજ્ય શ્રી ઉર્મિલાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી સોનલબાઈ મહાસતીજી, બોટાદ સંપ્રદાયના પૂજ્ય શ્રી શ્રેયાંસીબાઈ મહાસતીજી અને શ્રમણસંઘના

પૂજ્ય શ્રી સિદ્ધાયિકાજી મહાસતીજીએ સુંદર ભાવો સાથે શુભેચ્છા અર્પણ કરી હતી. સમસ્ત ઘાટકોપરના સાત શ્રી સંઘો અને શ્રી કલ્પતરુ સાધના કેન્દ્ર, સંસારી સ્વજનો આદિ અનેક ભાવિકોએ પૂજ્ય શ્રી મીરાબાઈ મહાસતીજીને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

પરમ ગુરુદેવને અર્પણ 'ગુજરાત ગૌરવ' પદવી:

શ્રી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના ઉપક્રમે પરમ ગુરુદેવના સંઘ, સમાજ અને સંપ્રદાય પ્રત્યેના અમૂલ્ય યોગદાનને અનુલક્ષીને 'ગુજરાત ગૌરવ' પદની ગૌરવવંતી અર્પણતા કરવામાં આવી હતી.

અહો લાભાર્થી :

ઘાટકોપરના આંગણે યોજાયેલ તપોત્સવ અંતર્ગત ગૌતમ પ્રસાદનો લાભ લઈને ધર્મવત્સલા શ્રી રીટાબેન પરેશભાઈ કોઠારી, શ્રી કિંજલબેન કેયુરભાઈ કોઠારી તેમજ સ્વામીવાત્સલ્યનો લાભ લઈ શ્રી ભાવિકભાઈ ઠોસાણી ધન્ય બન્યા હતાં.

અહો દાનમ્ :

હજારો નયન જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે ધન્યાતિધન્ય ક્ષણનો સાક્ષાત્કાર થયો હતો જ્યારે હજારો ભાવિકો દ્વારા લાવવામાં આવેલા ઇક્ષુ જળથી તપકેસરી મુનિરાજના પારણા કરાવવામાં આવ્યા હતા.

સામાન્ય જીવન
જીવી જનારાની નોંધ
નથી લેવાતી,
વિશિષ્ટ તપ કરનારા
ઇતિહાસ સર્જી જતાં હોય છે

ઉપસ્થિત સહુનાં હૃદયમાંથી ઉઠતા 'અહો દાનમ્, અહો દાનમ્ના ગુંજતા નાદમાં દિવસો સુધી ઉજવાઈ રહેલો તપોત્સવ એક ઇતિહાસ સર્જીને વિરામ પામ્યો હતો.

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાય સંસ્થાપક પ્રભાવક આચાર્યદેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ અને એમની પરંપરામાં થયેલા તપસ્વી પ્રશિષ્ય પૂજ્ય શ્રી માણેકચંદજી મહારાજ સાહેબ, એમના પ્રભાવક શિષ્ય સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ અને એમના તપસ્વી શિષ્ય તપસપ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ! આમ પ્રભાવક અને તપસ્વી ગુરુ-શિષ્યની જોડીમાં આ તપોત્સવ વધુ એક ગુરુ-શિષ્ય જોડી-શાસન પ્રભાવક એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ અને તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની જોડીના પાવન દર્શન કરાવી ગયો.

જેને તપમાં આનંદ અપાર અને પારણામાં આંસુનો પાર ન હોય તેની તપસ્યા સાર્થક થઈ જાય.

જે તપસ્વીના ચહેરા પર પારણા સમયે આનંદ હોય એની તપસ્યા નિરર્થક બની જાય.



(1) “પ્રાણ શિષ્ય શ્રુત સંપદા” ગ્રંથનું વિમોચન કરી રહ્યાં શ્રેષ્ઠિવર્યો
 (2) બાળ તપસ્વી શ્રી મોહિતભાઈ શાહ તપકેસરીના પારણા માટે ઇશુ જળ વહોરાવી રહ્યાં (3-4) તપકેસરી મુનિરાજને શાલ અર્પણ કરી રહ્યાં દાતા પરિવાર (5) શ્રી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સભ્યો “ગુજરાત ગૌરવ” પદ પરમ ગુરુદેવને અર્પણ કરી રહ્યાં (6) ઘાટકોપર તપોત્સવની અનુમોદના કરી રહ્યો વિશાળ જનસમુદાય.

પ્રભુ તમારા

પગલે... પગલે... ચાલ્યા

પરમ વિશુદ્ધિજી મહાસતીજી

અનંત તીર્થકર ભગવંતોએ ઉપવાસની આરાધના સાથે દીક્ષા જીવનનો પ્રારંભ કર્યો હોય તો હું પણ તે તીર્થકર પ્રભુના પગલે-પગલે ઉપવાસની આરાધના સાથે દીક્ષા મંત્ર ગ્રહણ કરીશ' આવી મંગલ ભાવના સાથે 20 ફેબ્રુઆરી, 2022ના દિવસે પરમધામના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગિકાર કરનારા નૂતનદીક્ષિત સાધ્વીરત્ના પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ ન માત્ર દીક્ષાના દિવસે ઉપવાસ કર્યો પરંતુ ગુરુકૃપાથી એક પછી એક ઉપવાસ આગળ વધતા ત્રીસ-ત્રીસ ઉપવાસ સ્વરૂપ માસક્ષમણ તપની ઉગ્ર આરાધના સાથે સંયમ જીવનનો પ્રારંભ કરીને એક ઇતિહાસ સર્જી દીધો.

દીક્ષા ગ્રહણ પછી ત્રીસ દિવસ સુધી એક પણ વાર સંયમ જીવનના ઉપકરણ એવા પાત્રમાં આહાર ન કરનારા 21 વર્ષીય પૂજ્ય નૂતનદીક્ષિત મહાસતીજીની ગુરુકૃપાએ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયેલી માસક્ષમણ તપની આરાધનાના પારણાનો અવસર પારસધામ- ઘાટકોપરના આંગણે અનેક સંતો, સાધ્વીવૃંદ અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

માસક્ષમણ તપ કરીને બનવું મારે તુજ સમ નિર્ગથ શ્રમણ

ગૌરવની અનુભૂતિ:

તપશ્ચર્યા દરમ્યાન તપસ્વી મહાસતીજીની અપ્રમત્ત દશા અને દૈનિક સંયમચર્યા પર પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીએ પ્રકાશ પાડવા સાથે આ અવસરે વિશેષ ભાવો સાથે ગોંડલથી પધારેલા સંપ્રદાય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોઠારીએ તપશ્ચર્યા સાથે સંયમનો પ્રારંભ કરનાર પૂજ્ય તપસ્વી મહાસતીજી પ્રત્યે અનેરું ગૌરવ અને અહોભાવ પ્રગટ કર્યો હતો.

ગુરુકૃપાએ પૂર્ણ થઈ મારી તપશ્ચર્યા:

નાની વય, નવદીક્ષિત અવસ્થા અને સાથે સાથે તપશ્ચર્યાની આરાધનાની આંતરિક અનુભૂતિ વ્યક્ત કરીને પૂજ્ય શ્રી તપસ્વી મહાસતીજીએ પરમ ગુરુદેવ પ્રત્યે હૃદયસ્પર્શી ભાવોમાં ઉપકાર અભિવ્યક્તિ કરી હતી.

અનુમોદનાના ત્યાગ છાંટણા:

આજીવન મીઠાઈ ત્યાગ, આજીવન hair cut ત્યાગ, કેશબુંચનના સંકલ્પ જેવી ત્યાગસભર પ્રતિજ્ઞા લઈને અનેક ભાવિકોએ તેમજ ઉદાર ભાવે ઉછામણીનો લાભ લેનારા બાળકોએ પૂજ્ય તપસ્વી મહાસતીજીને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

અનુમોદનાના ભાવ સાથે વહેતા સાંજી સ્તવનાના સૂરો વચ્ચે પૂજ્ય શ્રી મહાસતીજીને પારણા કરાવવામાં આવતા જય-જયકાર ગુંજી ઉઠ્યો હતો અને એ સાથે જ પારસધામના ભાવિકો દ્વારા પરમ ગુરુદેવ પ્રત્યે કરવામાં આવેલી હૃદયસ્પર્શી ભાવો સાથેની ઉપકાર અભિવ્યક્તિ અને ચાતુર્માસ વિનંતીની ઉર્મિઓ સાથે આ અવસર સંપન્ન થયો હતો.



■ Nitin Khara ■ Nalin Khara ■ Ilesh Khara

Call: 7620 250 251



Confidence Petroleum India Limited

Head Office : 4th Floor, Landmark, Above Big Bazaar, Wardha Road, Nagpur - 440012

Website: www.confidencegroup.co ■ gogas@confidencegroup.co ■ www.elitegogas.com ■ info@elitegogas.com ■   elitegogas



Inspired by
Rashtrasant Param Gurudev
Shree Namramuni Maharaj Saheb

ARHAM YUVA SEVA GROUP
CONDUCTED

MEGA ACTIVITIES

February - March 2022



ASHRAM SAHAY



3700+ Beneficiaries

EDUCATION SAHAY



4700+ Students

ARHAM AAHAR



21000+ Beneficiaries

JEEVDAYA



12000+ Jeevs

PADGHA TOLL ACTIVITY



900+ Truck Drivers

ARHAM ANUKAMPA



2400+ Fishes Rescued

JEEVDAYA - DOGS & PIGEONS



**Rotis for 300+ Dogs and
 200kgs of Chan for Pigeons**

PREETI DAAN AVSAR



**700+ pairs of clothes
 and 900 mithai boxes**

DIALYSIS SAHAY



NEW DIALYSIS CENTRES OPEN
 Ahmedabad | Bhavnagar | Chennai | Delhi
 Hyderabad | Kolkatta | Pune | Rajkot

DONATE NOW : www.arham.org | CONTACT : 7666708869